



COVID-19 મહામારી દરમિયાન બ્રેમ્પટનમાં વિક્ટોરિયા ડે 2021

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 19, 2021) – વિક્ટોરિયા ડે પર લાંબો વિકએન્ડ આવી રહ્યો છે! આ વર્ષે વિક્ટોરિયા ડે સોમવાર, મે 24 નાં રોજ આવશે.

સમુદાયને સહાયરૂપ થવા અગ્નિશમન અને કટોકટીની સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજાવણી, રોડ ઓપરેશન્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓનું રાખેતા મુજબનું સંચાલન ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા 905.874.2000 (બ્રેમ્પટન બહારથી) નંબર પર કોલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા વેબસાઈટ www.311brampton.ca પર ઈમેઇલ સરનામું 311@brampton.ca પર ઈમેઇલ મોકલી શકે છે. અમે સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલને સંબંધિત કોઈપણ બાબતો માટે 24/7 ઉપલબ્ધ છીએ. COVID-19 સંબંધિત પૂછપરછો માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/COVID19.

આતશબાજી સુરક્ષા

વિક્ટોરિયા ડે વર્ષમાં ચાર રજાઓમાંથી એક છે જ્યારે ખાનગી મિલકત પર ટૂંકા-અંતરના ફટાકડાઓ ફોડવાની છૂટ આપવામાં આવે છે, જેમાં બ્રેમ્પટનમાં પરમીટ લેવાની જરૂર પડતી નથી. બાય-લો (પેટા-કાનૂન) હેઠળ, આતશબાજીની પરવાનગી કેનેડા ડે, દિવાળી, અને નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ પણ આપવામાં આવે છે.

ફાયરવર્ક્સ બાય-લો અનુસાર ટૂંકા અંતરના ફટાકડા ફોડવાની પરવાનગી છે. ટૂંકા-અંતરના ફટાકડાઓ એ હોય છે જે ત્રણ મીટર (10 ફૂટ) કરતા ઓછું અંતર કાપતા હોય જ્યારે તે છોડવામાં આવે (દા.ત. ફાઉન્ટેઇન્સ, વ્હીલ્સ, ગ્રાઉન્ડ રિપનર્સ, સ્પાર્કલર્સ). રોકેટ જેવા અન્ય તમામ ફટાકડાં ફોડવાની બ્રેમ્પટનમાં મનાઈ છે. સીટી રહેવાસીઓને યાદ અપાવે છે કે ફટાકડાઓ સ્ટ્રીટ, સાઈડવોક્સ પર, શહેરના પાર્ક્સ કે અન્ય મ્યુનિસિપલ અથવા સ્કૂલ મિલકતોમાં ફોડવાની પરવાનગી નથી.

ખાનગી મિલકત પર ટૂંકા-અંતરના ફટાકડાઓ ઉપયોગમાં લેતી વખતે, રહેવાસીઓએ નીચેની સુરક્ષા સાવચેતીઓ અચૂક અનુસરવી રહી:

- ફટાકડાં હોલવવા પાણી ભરેલું પાત્ર અથવા પાણી ભરેલી હોઝ લાઈન પોતાની પાસે ઉપલબ્ધ રાખો.
- તમારા હાથમાં સ્પાર્કલર સિવાય કોઈ ફટાકડા ક્યારેય ફોડશો નહિ કે પકડી રાખશો નહીં.
- ફટાકડાં અન્ય લોકો પર ક્યારેય ફેંકશો નહિ કે ચિંધશો નહીં.
- સ્પાર્કલર્સનો ઉપયોગ કર્યા પછી, તેનો નિકાલ કરતા પહેલાં તેને પૂરેપૂરા ઠંડા પાડવા પાણીના પાત્રમાં રાખો.
- બધાં ફટાકડાનો નિકાલ કરતા પહેલાં તેને પૂરેપૂરા ઠંડા થવા દો.

દર વર્ષે, ફટાકડા વિક્રેતાઓ ફટાકડા વેચવાનું લાઈસન્સ મેળવે ત્યાર પહેલાં તેઓએ સીટીની તાલીમ લેવી અનિવાર્ય છે. સીટીએ વિક્રેતાઓને ઓનલાઈન તાલીમ આપવાની તૈયારી બતાવી. વિક્ટોરિયા ડે માટે નવા ફાયરવર્ક્સ લાઈસન્સીસ આપવામાં આવ્યા નથી. જો સ્ટોર્સમાં કે બ્રેમ્પટનમાં બીજે ક્યાંય ફટાકડા વેચાતા હોવાનું રહેવાસીઓના ધ્યાનમાં આવે તો, તે બાબતની જાણ બ્રેમ્પટન 311 મોબાઈલ એપ, [ઓનલાઈન](http://www.311brampton.ca), અથવા 311 નંબર પર કોલ કરીને સર્વિસ બ્રેમ્પટનને જણાવવાનું કહેવામાં આવે છે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ વિક્ટોરિયા ડે પર રવિવાર/રજાના દિવસના સમયપત્રક પ્રમાણે ચાલુ રહેશે જેમાં કેટલાક રૂટ્સ રદ કરવામાં આવશે. નીચે જણાવેલા રૂટ્સ સર્વિસમાં રહેશે:

- 501 ઝુમ ક્વીન
- 502 ઝુમ મેઈન
- 505 ઝુમ બોવેઈર્ડ
- 511 ઝુમ સ્ટીલ્સ
- 1 ક્વીન
- 2 મેઈન
- 3 મેકલાક્લિન
- 4 ચિંગકુસી
- 5 બોવેઈર્ડ
- 7 કેનેડી
- 8 સેન્ટર
- 11 સ્ટીલ્સ
- 14 ટોરબ્રામ
- 15 બ્રેમલી
- 18 ડિક્સી
- 23 સેન્ડલવૂડ
- 29 વિલિયમ્સ
- 30 એરપોર્ટ રોડ
- 35 ક્લાર્કવે
- 50 ગોર રોડ
- 52 મેકમર્કી
- 53 રે લોસન
- 56 કિંગનોલ
- 57 ચારોલેઈસ
- 115 પીયરસન એરપોર્ટ એક્સપ્રેસ

વિક્ટોરિયા ડે પર ટર્મિનલ્સ પરના કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ બંધ રહેશે. વિક્ટોરિયા ડે પર ઉતારુઓને સહાયરૂપ થવા કોન્ટેક્ટ સેન્ટર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. વધુ માહિતી માટે, કોન્ટેક્ટ સેન્ટરને 905.874.2999 નંબર પર કોલ કરો અથવા વેબસાઈટ www.bramptontransit.com જુઓ.

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સપ્ત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સપ્ત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી ઉતારુઓને માસ્ક પહેર્યો હોય તો પણ ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું ચાલુ રાખવાની વિનંતી કરે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે. જો બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો, સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાઈટ પર પરીક્ષણ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.



BRAMPTON

Service and Information Update

અઘતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કોન્ટેક્ટ સેન્ટરને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

બ્રેમ્પટન પાર્ક્સ

વિક્ટોરિયા ડે માટે બ્રેમ્પટનમાં લીશ-ફી ડોગ પાર્ક્સ સહિત, બંધી ટ્રેઈલ્સ (પગદંડીઓ), પ્લેગ્રાઉન્ડ્સ, અને પાર્ક્સ ખુલ્લા રહે છે. દરેક વ્યક્તિના આરોગ્ય અને સુખાકારી માટે શારીરિક પ્રવૃત્તિ મહત્વની છે – જો તમે આ વિક્ષેત્રમાં બ્રેમ્પટનમાંના પાર્ક્સની મુલાકાત લેવાના હો તો, કૃપા કરી તમારા ઘરની બહારના લોકોથી 2 મીટરનું અંતર જાળવવાનું અને જો આ મુશ્કેલભર્યું લાગે તો માર્ક પહેરવાનું યાદ રાખશો. આપણાં પાર્ક્સ અને ટ્રેઈલ્સ શોધવા વેબસાઈટ www.brampton.ca/parks જુઓ.

બ્રેમ્પટન રિક્રિએશન

રેક એટ હોમ (Rec At Home)

ઘરે ઓનલાઈન ફિટનેસ અને ક્રાફ્ટ ટ્યુટોરિયલ્સ સાથે સક્રિય અને પ્રવૃત્તમય રહો! સંપૂર્ણ બોડી સરકિટ અજમાવી જુઓ, ઓરિગામી હાટ્સ બનાવવાની રીત શીખો, તમારી કેલિગ્રાફી આવડતો, અને ઘણાં બધાંનો મહાવરો કરો. રેક એટ હોમ (Rec At Home) પ્રવૃત્તિઓમાં અહીંથી પ્રવેશો, www.brampton.ca/recathome.

પ્રોવિન્સના COVID-19 લોકડાઉન ઉપાયો સામે પ્રતિક્રિયા કરવામાં સીટી ઓફ બ્રેમ્પટનના રિક્રિએશન સેન્ટર્સ હંગામી ધોરણે બંધ છે અને રૂબરૂમાં ઈન્સ્ટ્રક્ટરની આગેવાનીમાં મનોરંજન કાર્યક્રમો અને સેવાઓ સ્થગિત છે. વર્ચ્યુઅલ કાર્યક્રમો અને સેવાઓ પર માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/recreation.

બ્રેમ્પટન લાઈબ્રેરી

વિક્ટોરિયા ડે પર બ્રેમ્પટનની બંધી લાઈબ્રેરીઓમાં [કર્બસાઈડ પિકઅપ સ્થળો](#) બંધ રહેશે.

અમારી ડિજિટલ લાઈબ્રેરી કોઈપણ સમયે જોવા [બ્રેમ્પટન લાઈબ્રેરીની વેબસાઈટ](#) જુઓ. અહીં તમે તમારા લાઈબ્રેરી કાર્ડ વડે ડિજિટલ ઈ-બુક્સ, ઈ-ઓડિયો બુક્સ, ટીવી અને મૂવી સ્ટ્રીમિંગ, ઓનલાઈન લર્નિંગ, અને આર્ટ્સ અને ક્રાફ્ટ્સને લગતું શિક્ષણ અને ઘણું બધું સુધી મફતમાં પહોંચ મેળવશો. [બ્રેમ્પટન લાઈબ્રેરી કાર્ડ મેળવવા, કૃપા કરી અહીં ક્લિક કરો.](#) બંધી શાખાઓમાં 24-કલાકની બાહ્ય ડ્રોપ બોક્સીસ મારફતે તમે ઊછીનું લીધેલું સાહિત્ય પરત કરવાની લચીલી સેવાઓ મેળવો. નોંધણી કરાવો અને અમારા વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં [કેલેન્ડર ઓફ ઈવેન્ટ્સ](#)માં ભાગ લેવાનું અને અઠવાડિક વર્ચ્યુઅલ સ્ટોરીટાઈમ્સ સહિત વીડિયોનો આનંદ [બ્રેમ્પટન લાઈબ્રેરીના YouTube પેજ](#) પર માણવાનું આયોજન કરો.

યાલો આપણે સંપર્કમાં રહીએ! [અમારી ઈમેઈલ અપડેટ્સ સબસ્ક્રાઈબ કરો](#) અને અમને [Facebook](#), [Twitter](#), અને [Instagram](#) પર અનુસરો.

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર વિક્ટોરિયા ડે નિમિત્તે બંધ રહેશે.



એનિમલ કંટ્રોલ (પ્રાણી નિયંત્રણ) સોમવારથી શુક્રવાર સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અને શનિવારે અને રવિવારે અને રજાઓના દિવસોમાં સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રોડ પર હોય છે, અને માત્ર નીચેના કોલ્સને પ્રતિભાવ આપશે:

- માંદા/ઇજા પામેલા/આક્રમક ઘરેલું પ્રાણીઓ અને વન્ય જીવોને લઈ જવા
- આક્રમક પ્રાણી
- દોડીને ભાગતા કૂતરા
- કૂતરું કરડવાની તપાસ કરવી
- બંધિયાર રખડતું કૂતરું લઈ જવું
- મરેલું પ્રાણી લઈ જવું

આ સિવાયના સમયે, એનિમલ કંટ્રોલ માત્ર ઈમરજન્સીમાં પ્રતિભાવ આપશે.

વિક્ટોરિયા ડે વીકએન્ડ માટે પીલ પબ્લિક હેલ્થના રિમાઈન્ડર્સ

ગુરુવાર, મે 20 નાં રોજ, સવારે 9 વાગ્યા સુધી, 12+ ઉંમરની પીલમાં રહેતી, કામ કરતી કે સ્કૂલમાં જતી વ્યક્તિઓ પીલ રીજીયનમાં એપોઈન્ટમેન્ટનું બુકિંગ કરાવવાને પાત્ર હશે. રસીકરણ સમયે 12 વર્ષ અને વધુ ઉંમરની વ્યક્તિઓ માટે બુકિંગ્સ સ્વીકારવામાં આવશે. Pfizer (ફાઈઝર) એકમાત્ર રસી છે જેને આ ઉંમર સમૂહ માટે હેલ્થ કેનેડાએ અધિકૃત કરી છે. વેક્સિન્સનું બુકિંગ રીજીયન ઓફ પીલની વેબસાઈટ પર અહીં કરી શકાય છે: www.peelregion.ca/coronavirus/vaccine/book-appointment/

લાંબા વિકએન્ડ પર માત્ર તમારી સાથે રહેતા લોકો સાથે ભેગા થઈને એકબીજાની સંભાળ રાખશો.

વેક્સિન આપવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે, આપણાં જાહેર આરોગ્ય ઉપાયોમાં છૂટ આપવા કેસીસની ગણતરીમાં ઘટાડો લાવવામાં સમય લાગશે એ યાદ રાખવું મહત્વનું છે.

નીચેની જાહેર આરોગ્ય સલાહ હજુ પણ આપણો શ્રેષ્ઠ બચાવ બની રહે છે. તમારા ઘરની બહાર રહેતા કુટુંબીજનો અને મિત્રો માટે, ફોટા પાડો અને એકબીજા સાથે સંકળાયેલા રહેવા વર્ચ્યુઅલ કોલ્સ કરો અને વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવો.

-30-

સીટી ઓફ બ્રમ્પટન મીડિયા સંપર્ક

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ (Coordinator, Media & Community Engagement)

સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન (Strategic Communication)

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

રીજીયન ઓફ પીલ મીડિયા સંપર્ક

એશલી હોક્કિન્સ (Ashleigh Hawkins)

કમ્યુનિકેશન્સ સ્પેશિયલિસ્ટ – જાહેર આરોગ્ય

રીજીયન ઓફ પીલ

416.818.4421 | ashleigh.hawkins@peelregion.ca